

Apbml/Exch./2023-24/26 07th September, 2023

To,
Corporate Relationship Department,
BSE Limited,
P.J Towers,
Dalal Street, Fort,
Mumbai- 400 001
Company Code- 540824

To,
Corporate Relationship Department
National Stock Exchange of India Ltd.
Exchange Plaza, C-1, Block- G,
Bandra- Mumbai- 400 051
Company Code- ASTRON

Dear Sir/Madam,

Sub: Newspaper Publication for the 13th Annual General Meeting, E-voting, Cut-off Date and Book Closure Dates

With reference to the above subject and pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copy of the newspaper advertisement for notice of the 13th Annual General Meeting, E-voting, Cut-off Date and Book Closure dates published in the Indian Express, English Edition and Financial Express, Gujarati Edition, dated September 07, 2023.

Kindly take on your record.

Thanking you.

Yours Faithfully, For Astron Paper and Board Mill Limited

Hina Ronak Patel

Digitally signed by Hina Ronak Patel Date: 2023.09.07 19:41:35

Hina Ronak Patel Company Secretary and Compliance Officer

Encl, As Above.

Reg Office: D-702, Ganesh Meridian, Opp High Court, S G Highway, Ahmedabad-380060.

Phone No: +91: 079 - 40081221 Email id: info@astronpaper.com Website: www.astronpaper.com CIN:L21090GJ2010PLC063428 THE INDIAN EXPRESS, THURSDAY, SEPTEMBER 7, 2023

GUJARAT

13 ARRESTED IN RAJKOT

Police station gheraoed after raid on gambling dens, bootleggers

EXPRESS NEWS SERVICE RAJKOT, SEPTEMBER 6

A MOB OF around 30 persons, including eight women, allegedly gheraoed the Thorala Police Station in Rajkot past midnight, abused the policemen on duty, and threatened them of dire consequences if they continued raids against gambling dens and bootleggers, officials have said.

The mob allegedly reached the police station at around 12:05 am on Wednesday against what they described as frequent raids in their locality in the Thorala area.

They gheraoed the police station and didn't disperse despite repeated warnings. They were forcibly dispersed by the local staff and 13 people from the mob were detained. However, no force was used,"

OEXPRESS NEWS SERVICE

TWO PERSONS were arrested by

the Vadodara rural police station

on Wednesday for allegedly ab-

ducting a city-based businessman

at gunpoint and driving him

around the national highway in

his own sports utility vehicle

(SUV) for five hours until they

were busted by a police patrol van

midnight when Rashmikant

Pandya (50), who owns an engi-

neering firm in Vadodara city, was

driving back home alone from a

torcycle-borne men – Manjitinder

Singh Rai and Satnam Singh

Gurmit Singh Rai, both aged 32 –

allegedly accosted Pandya's SUV

near Fatehgunj and forced them-

selves into the car in the guise of

going to a police station, as the

businessman was allegedly driv-

ing rashly. Once inside the car, the

accused pulled out a pistol and

According to the FIR, two mo-

The incident occurred around

in the wee hours.

family dinner.

VADODARA, SEPTEMBER 6

Police Commissioner Raju Bhargav said that Thorala and Kubaliyapara areas are "notorious" for such illegal activities

Commissioner Raju Bhargav told The Indian Express.

"We have registered an FIR and all 13 persons have been arrested formally," he added.

The Police Commissioner said that Thorala and Kubaliyapara areas are "notorious" for gambling and bootlegging, and frequent raids are carried out in these areas to crack down on these criminal activi-

Police inspector BM Zankat. in charge of Thorala Police Station, said that 10 persons

Businessman abducted on gunpoint,

accused busted by cops on highway

asked Pandya to continue driving.

Pandya has alleged that the two

men took away Rs 3,500 in cash

from his wallet and three cell-

phones before assaulting him

when he refused to sign blank

cheques in the three cheque

books that the accused found in

cused then asked him to hand

over the steering wheel, tied his

hands and blindfolded him, be-

fore driving first to a hotel in

Kathiyawadi, which had closed

ing for food... They reached a ho-

tel in Kathiyawadi and removed

my blindfold but threatened me

AMDAVAD MUNICIPAL CORPORATION

INTERNATIONAL DAY OF

CLEAN AIR FOR BLUE SKIES

7[™] SFPTFMRFR 2023

#WORLDCLEANAIRDAY #TOGETHERFORCLEANAIR

#NATIONALCLEANAIRPROGRAMME

GREENER LANDSCAPES

GOOD CONSTRUCTION

DUST CONTROL

DUST FREE ROADS

SUSTAINABLE PUBLIC

BETTER TRAFFIC

Date: 06.09.2023

"They (accused) were search-

Pandya added that the ac-

In his complaint to the police,

The two

arrest.

men after

were detained from the spot and action was initiated against others subsequently after an FIR was launched on the basis of a complaint filed by a police constable.

"The staff on duty tried to pacify them and asked if they had any specific representation

to make," he said. "However, instead of making any representation, some from the mob started uttering foul words and started asking why police were conducting raids in their locality only in the name of cracking down on liquor and gambling and why PCR (police control-room van) was making rounds of their area only. Despite such unnecessary arguments, the staff tried to persuade them. However, they tried to deter police from discharging their duty and take law into their hands by forming a mob, creat-

if I uttered a word. Since they were

armed, I complied. At the hotel,

which was closed, one of the two

waited with me while the other

drove away in my vehicle and re-

turned half-an-hour later. They

pushed me back into the car and

headed to a highway hotel near

Por in Vadodara district, where

they ate dinner while I sat beside

them," Pandya has said in his

turned to the highway, driving

Pandya's car when a police patrol

van on the highway intercepted

legedly grabbed the opportunity

to seek help and the abductors

were busted. "While the police

first directed me to Fatehgunj po-

lice station to register the FIR, I was

redirected to the Vadodara rural

police station, where I filed my

complaint," Pandya has stated in

Vadodara rural police station said,

"We are planning to seek seven

days remand from a local court."

G200 | U200 | U2

Inspector Viram Lamariya of

his complaint.

It was then that Pandya al-

the SUV randomly for a check.

The accused then allegedly re-

complaint.

ing threats to police," Zankat further added.

The First Information Report names 25 persons, including eight women.

They have been booked under IPC sections 120B (criminal conspiracy), 143 (unlawful assembly), 145 (joining or continuing in an unlawful assembly, knowing it has been commanded to disperse), 147 (rioting), 149 (every member of unlawful assembly guilty of offence committed in prosecution of common intent), 186 (obstructing public servant in discharge of public functions), 294B (sings, recites or utters any obscene song, ballad or words, in or near any public place), 353 (assault or criminal force to deter public servant from discharge of his duty), 504 (intentional insult with intent to provoke breach of the peace), and 506 (criminal intimidation), officials said.



Invoking THE **DIVINE**

Women pray to Goddess Shitala for the protection of their children on the occasion of Shitala Satam, in Vadodara on Wednesday.

Golden Opportunity

to start your

business with UPSIDA

Beginning date for Documents download and

Last date for Final Online Documents Submission

Unnao, Chandauli, Mathura, Aligarh, Etah, Amethi, Shahjahanpur,

Jalaun, Hamirpur, Kanpur, Fatehpur, Hardoi, Saharanpur, Gautam

Buddh Nagar, Baghpat, Mainpuri, Jhansi, Fatehpur, Varanasi.

Call Center Ph: 022-22811110 | E-mail: etender.support@sbi.co.in

(Monday to Friday 10:00 AM to 7:00 PM and 1st & 3rd Saturday 10:00AM to 6:00 PM

Last Date For Online Payment of Catalogue Fee (Document Fee),

Application Submission

Processing Fee and EMD

Online Bidding Starts for all Plots

ओएनजीसी



NOTICE
The project Onshore Oil and Gas Exploration & Appraisal from 46 exploratory wells in 17 ML Blocks in Mehsana and Gandhinagar, Kheda and Anand district of Gujarat by M/S Oil and Natural Gas Corporation Limited has been accorded Environmental Clearance by the Ministry of Environment, Forest and Climate Change through SEIAA (State Environment Impact Assessment Authority) vide order No. SEIAA/GUJ/1(b)/923/2023, Dated: 19 July, 2023. Coples of clearance letter are available with the GPCB and also be seen at Website of the Ministry at https://environmentclearance.nlc.in

PAUSHAK LIMITED

CIN: L51909GJ1972PLC044638

Read. Office Address: Alembic Road. Vadodara - 390 003 Website: www.paushak.com | Email: investors@paushak.com Tel: +91 265 6637300

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE(S)

Notice is hereby given that the following Equity Shares Certificate(s) of the Company have been transferred to Investor Education and Protection Fund (IEPF) Authority and the registered equity shareholder(s) have reported them as lost/ misplaced and for the purpose of claiming the shares from IEPF Authority, the registered equity shareholder(s) have applied to the Company for the issue of duplicate Equity Shares Certificate(s).

Shareholder's and/or	Folio	Certificate	Distinctive	No. of
Claimant's Name	No. (s)	No. (s)	Nos.	Shares
P Maruthai	P03498	2042	924461-924760	300

The Public is hereby warned against purchasing or dealing with these securities in any way. Any person(s) having any claim in respect of the aforesaid Equity Shares Certificate(s), should immediately send full details with documentary evidence to the Company's RTA - Link Intime India Private Limited at its office at B-102 & 103, Shangrila Complex, First Floor, Opp. HDFC Bank, Near Radhakrishna Char Rasta, Akota, Vadodara - 390020 or to the Company at its Registered Office mentioned above, so as to reach us within 15 days from the date of publication of this Notice, failing which, the Company will proceed to issue duplicate equity shares certificate(s) without further

Please note that no claims will be entertained by the Company or the RTA with respect to origina Equity Share Certificate(s) subsequent to the issue of duplicate(s) thereof

Date: 6th September, 2023 Place: Vadodara

Sagar Gandhi

This Notice shall also be available at Investor Section of the Company's website www.paushak.com and

ASTRON PAPER & BOARD MILL LIMITED

Reg Office: D-702, 7th Floor Ganesh Meridian, Opp. High Court, S.G. Highway, Ahmedabad-380060 Tel: (079) 40081221, Fax: (079) 40081220 CIN: L21090GJ2010PLC063428 Web:www.astronpaper.com Mail: cs@astronpaper.com

NOTICE OF 13TH ANNUAL GENERAL MEETING REMOTE E - VOTING INFORMATION, CUT - OFF & BOOK CLOSURE DATES.

NOTICE is hereby given that the 13th Annual General Meeting of members of the Company will be scheduled to be held on Friday, 29th September, 2023 at 11:00 A.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") pursuant to Ministry of Corporate Affairs (MCA) circular dated 28th December, 2022, 5th May, 2022, 13th January, 2021, 5th May, 2020, 8th April, 2020 and 13th April, 2020 and Securities Exchanges Board of India (SEBI) circular dated 12th May, 2020, 13 January, 2021, 13th May, 2022 and 5th January, 2023 to transact the business as mentioned in the AGM Notice dated 12th August, 2022 of the Meeting.

The Notice of 13th AGM and Annual Report- 2022-23 has been sent to all the members whose E-mail IDs are registered with the Company / Depository Participant(s) on 25th August, 2023 and are also available on the website of the Company at www.astronpaper.com and also available on BSE Limited on www.bseindia.com and on National Stock Exchange India at www.nseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com

Further in compliance with the provisions of the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administrative) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the members are provided with the facility to cast their vote on all the resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system (evoting) provided by CDSL. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid up equity share capital of the Company as on Friday 22nd September, 2023. (Cut-off date).

The remote e - voting shall commence on Tuesday, 26th September, 2023 (10:00 A.M. IST) and shall end on Thursday, 28th September, 2023 (05:00 P.M. IST). During this period the members may cast their vote electronically. Voting through the remote e-voting shall not be allowed beyond 05:00 P.M. IST on Thursday, 28th September, 2023. Those members who shall be present in the AGM through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility and had not cast their votes on the Resolutions through remote evoting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

Members of the Company holding shares as on cut-off date may cast their votes.

Any person, who becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding shares $as of the \, cut-off \, date \, may \, cast \, their \, votes \, by \, following \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, in \, the \, instructions \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, of \, e-voting \, as \, provided \, and \, process \, and \, process$ Notice of the AGM.

In case members have not register their email addresses, they may follow the following instructions. a) Members holding shares in the physical mode are requested to send their request by an email to our Register & Transfer Agent i.e Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in and to the Company at cs@astronpaper.com along with the necessary details such as Folio Number, Name of the members Email Id, Mobile No, Self-attested copies of PAN and address proof for the registering their email ids.

b) Members holding shares in Demat mode are requested to contact their respective Depository Participant for

For the details relating to e-voting/remote e-voting, please refer to the notice of the 13th AGM. In case of any queries / grievances pertaining to e-voting/remote e-voting, you may refer the Frequently Asked Questions and e – voting user manual available at the CDSL's website i.e. www.evotingindia.com under help section or contact Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, $Mafatlal \ \ Mill \ \ Compounds, \ \ N \ \ M \ \ Joshi \ \ Marg, \ \ Lower \ \ Parel \ \ (East), \ \ Mumbai \ \ - \ \ 400013. \ \ E-mail:$ helpdesk.evoting@cdslindia.com. Tel No: 022- 23058738 or 022-23058542 or 022-23058543 during the working hours on all the working days.

Notice is also given pursuant to Section 91 of the Companies Act, 2013 the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, 23rd September, 2023 to Friday, 29th September, 2023 (both days inclusive) for the purpose of 13th Annual General Meeting (AGM) of the Company.

For, ASTRON PAPER AND BOARD MILL LIMITED

Hina Ronak Patel Company Secretary & Compliance Officer



AM/NS Ports

AMNS PORTS INDIA LIMITED (FORMERLY HAZIRA CARGO TERMINALS LIMITED)

Regd. Office: AMNS House, AMNS Township, 27th K. M., Surat Hazira Road, Hazira, Surat, Gujarat **-** 304 270 Tel: +91 22 6988 9999 Email: cs.portsindia@amns.in Web: www.amns.in CIN: U61100GJ1993PLC019238

NOTICE

Notice is hereby given that the 30th Annual General Meeting of AMNS Ports India Limited (formerly Hazira Cargo Terminals Limited) will be held on Thursday, September 28, 2023 at 11.00 a.m. IS through video conferencing/other audio visual means ("OAVM") ("AGM"/"the meeting") organized by the Company. The venue of the meeting shall be deemed to be the Registered Office of the Company at AMNS House, AMNS Township, 27th K. M., Surat Hazira Road, Hazira, Surat, Gujarat - 304270, India.

The Notice convening the meeting has been sent to the members to their registered address electronically by email to those members who have registered their email address with the Depositories/Company

The Notice convening the meeting is available on the Company's website www.amns.in and on the website of National Securities Depository Limited (NSDL) https://www.evoting.nsdl.com. Physical copy of the notice of AGM will not be sent this year. In terms of Section 108 of the Companies Act, 2013 ("the Act")

and the rules made thereunder, the Company is providing electronic voting (e-voting) facility to its members for voting on the business as specified in the Notice convening the meeting of the Company. Members are informed that the e-voting commences on

Sunday, September 24, 2023 at 9.00 a.m. and ends on Wednesday, September 27, 2023 at 5.00 p.m. The e-voting module shall be disabled for voting after 5.00 p.m. on Wednesday, September 27, 2023. Once the vote on a resolution is cast by the members, the members shall not be allowed to change it subsequently. The Notice of the meeting is available on the Company's website @ www.amns.in.

Notice is also hereby given that the Company has fixed Thursday September 21, 2023 as the record date for the purpose of identifying the members for the purpose of AGM who are entitled to vote on the Resolutions set forth in the Notice

Any person who becomes member of the Company after dispatch of the Notice of the Meeting and holding shares as of the cut-off date may obtain the User ID and password inter alia by sending a request at evoting@nsdl.co.in. The detailed procedure for obtaining User ID and password is also provided on NSDL's website and in the Notice of the meeting which is available on Company's website. If the member is already registered with NSDL for e-voting, he can use his existing User ID and password for casting the vote through remote e-voting. The members who have cast their vote(s) by remote e-voting

may also attend the Meeting but shall not be entitled to cast their vote(s) again. The facility for e-voting will be made available immediate after the Meeting and will last for 15 minutes after conclusion of the AGM and members attending the Meeting who have not cast their vote(s) by remote e-voting will be able to vote after Meeting through e-voting.

In case of any queries, members may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of or pallavid@nsdl.co.in or at telephone Nos. +91-22-24994360 or

www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request to Mr. Amit Vishal, Senior Manager or Ms. Pallavi Mhatre, Manager NSDL at evoting@nsdl.co.in; or amitv@nsdl.co.in; + 91-9920264780 or +91-22-24994545 who will also address the grievances connected with the voting by electronic means.

By order of the Board of Directors Amit Harlalka

Place: Mumbai Date: September 07, 2023

Director DIN.: 08710525

SMARTER

BRIGHTER **FUTURES**

STEELS











RO JEWELS LIMITED

CIN: L74999GJ2018PLC105540 REGD. OFFICE: 810, Eighth Floore, Addore Asspire, Nr. Gulhaltekra BRTS Stop Panjrapole to University Road S A C Ahmedabad-380015 Phone: 07922144429 / 22153329

Email: compliancerojewels@gmail.com Web: www.rojewels.co.in

NOTICE OF 5TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 5th **Annual General Meeting** (AGM) of the Members of **RO Jewel Limited** is scheduled to be held on **Friday, 29th September, 2023** at 04:45 PM through Vide Conference ("VC") / Other Audio Visual Means ("OVAM) to transact the business as set out in the Notice of the 5" AGM, which is being circulated for convening the AGM. The Company has already dispatched the Annual Report for the Financial Year 2022-23 along with the Notice convening 5" AGM through electronic mode to the Shareholders whose email address are registered with the Company and / or Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice of 5" AGM also available on the website of the company at www.rojewels.co.in and on the website of National Depositories Services Limited (NSDL) at www.evoting.nsdl.com.

As Per Section 108 of the Companies Act,2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2") Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting (SS-2) issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all is Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share of the Company as on Friday, September 22, 2023 (the "cut-off date"), The details are required ursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below: The Book closure period shall commence on 23rd September, 2023 and end on 29th September 2023 (both days inclusive);

- 2. The remote e-voting period will commence at 09:00 a.m. on Tuesday, September 26, 2023 and will end at 05:00 p.m. on Thursday, September 28, 2023.
- 3. Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, September 22, 2023;
- . The members will not be allowed to vote through remote e-voting beyond the period as specified above; Shareholder acquiring the share of the company and becomes the members of the company after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention in the Notice of AGM to exercise their voting rights;
- . The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend participate in the AGM but shall not be entitled to cast their vote again.
- The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary to act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of voting to the Chairman.
- In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequent Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholder available at www.evoting.nsdl.com under help section or contact at 022-23058542/43.

Date: 06/09/2023

FOR, RO JEWELS LIMITED sd/- Shubham Bharathhai Shah Managing Director (DIN: 03144827)

APOLLO Gujarat Apollo Industries Limited CIN: L45202GJ1986PLC009042, www.apollo.co.in

Regd. Off: Block No. 486, 487, 488, Mouje Dholasan, Taluka & District: Mehsana-382732 Corp. Off: "Parishram", 5-B, Rashmi Society, Nr. Mithakhali Six Roads, Navrangpura, Ahmedabad-380009. NOTICE OF THE 36thANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 36thAnnual General Meeting (36thAGM) of the Members of Gujarat Apollo Industries Limited will be held on Saturday, 30thSeptember, 2023 at 11.00 A.M. at the Registered office of the Companyto transact the business, as set out in the Notice of the 36thAGM.

The Company has sent the Annual Report along with Notice convening AGM on 6th September, 2023, physically to those members who have not registered their emai IDs and through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/s. Link Intime India Private Limited/ Depository Participant (s) for communication purpose. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.apollo.co.in, BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Sunday, 24th September, 2023 to Saturday, 30th September, 2023 (both days inclusive) for the purpose of 36thAGM of the

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the CDSL on all resolutions as set forth in the 36thAGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Saturday, 23rdSeptember, 2023 ('cut-off date').

The remote e-voting period commences on Wednesday, 27thSeptember, 2023 at 9.00 a.m. and will end on Friday, 29thSeptember, 2023 at 5.00 p.m. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM physically and had not cast their votes on the Resolutions through remote evoting and are otherwise not barred from doing so, shall be eligible to vote through Ballot Papers during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend /participate in the AGM but shall not be entitled to cast their votes again. The manner of remote e-voting is provided in the Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any gueries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to $\underline{\text{helpdesk.evoting@cdslindia.com}} \text{ or contact at toll free number } 1800\,22\,55\,33.$

Place: Ahmedabad Date:06.09.2023

For, Gujarat Apollo Industries Limited (Mem No A-25420) Company Secretary & Compliance Officer We. (1) TULIKA TRILOK AGARWAL. (2) NIRMAL TRILOKCHAND AGARWAL. (3) PRASHANT VEDPRAKASH AGARWAL. (3) PRASHANT VEDPRAKASH AGARWAL. Jointly hold 800 shares in Folio No. UB052393 bearing Share Certificate No. 10236; Distinctive Numbers from 753941-754740 and jointly hold 100 shares in Folio No. UB052393 bearing Share Certificate No. 120231; Distinctive Numbers from 216061159 - 216061258 of UNITED BREWERIES LIMITED having it's Registered Office at "UB TOWER", UB City, #24, Vittal Mallya Road, Bengaluru-560001.

City, #24, Vittal Mallya Road, Bengaluru-560 001.

That, in the above mentioned Certificates, our name is Registered and mentioned as 1. TULIKA TRILOK CHAND, 2. NIRMAL TRILOK CHAND and 3. PRASHANT TRILOK CHAND and in our PAN Card and DP CML the name is mentioned as 1. TULIKA TRILOK AGRIWAL 2.) NIRMAL TRILOK AGRIWAL 2.) NIRMAL TRILOK AGRIWAL 2.) NIRMAL TRILOK AGRIWAL Which are One and the Same Only.

We have applied to the company and its RTA for issue of duplicate for 100 shares and for issue of letter of confirmation in names as per PAN and DP CML for facilitating demat of the said shares.

Date: 07.09.2023 ace: Ahmedabad

NATIONAL SEEDS CORPORATION LTD.

(A Govt. of India Undertaking-Mini Ratna Company)

CIN No.U74899DL1963GOI003913

RO : Block-AQ, Plot -12, Sector-5, Salt Lake, Kolkata-700 091 Ph. 033-2367-1077 / 74, E-mail : nsc.kolkata.ro@gmail.com

सं.:- अपि – 08(BBSR-TCL-EQP)/ एन.एस.सी. : कोल/2023-24/ दिनांक : 06-09-2023 <u>नोटिस</u>

Short Term e-Tender Notice for Enhancement of existing transformer capacity at NSC, Bhubaneswar supply, Installation & Commissioning) for arranging Power Supply to the extended load of Tissue Culture Lab at NSC, Bhubaneswar along with all necessary allied approval from concerned Electricity Department.

For details, please visit NSC's website www.indiaseeds.com under Public Notice (Tender/Quotations). Online Bids for above tender must be submitted at NSC e-Portal https://indiaseeds.enivida.com latest by 14:30 Hrs. of 12-09-2023. Corrigendum / addendum, if any, shall only be published in NSC's website.

क्षेत्रीय प्रबंधक एन.एस.सी., कोलकाता



Regional Office, Ahmedabad : The South Indian Bank Ltd., Regional Office, Ahmedabad : 4th Floor, Sakar VII, Nehru Bridge Jn. Ashram Rd. Navrangpura, Ahmedabad Guiarat-380009, Tel/Fax No. 079-2658 5600, 5700

POSSESSION NOTICE (For Im

Whereas, the undersigned being the Authorised Officer of South Indian Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Deman Notice dated 20.09.2018 calling upon the Borrower / Mortgagers / Guarantors Mr. Ravi Kishanchand Hukumani & Mr. Kishanchand Hukumani to repay the amount mentioned in the notice being Rs. 8,54,748/- (Rupees Eight Lakhs Fifty Four Thousand Seven Hundred Forty Eight Only) as on 07.09.2018 with further interest @9.00% Per annum With Yearly rests and Penal Interest @ 2% Per Annum together with further interest, charges and other incidental expenses, costs thereon, till date of

The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned as per The Honourable Bhu District Collector Order No.: MEG/POL-1/SRSAESI/CASE NO. 56/2020, dated 18.12.2021 has taken **PHYSICAL POSSESSION** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read wit rule 8 of the said rules on this 04th day of month September of the year 2023.

The Borrower in particular and the public in general is hereby cautioned not to dea with the property and any dealings with the property will be subject to the charge of the The South Indian Bank Ltd. for an amount Rs. 14,05,866.85 (Rupees Fourteen Lakh Five Thousand Eight Hundred Sixty Six and Paisa Eighty Five Only) as on 02.09.2023 with further interest @9.45% Per annum With Yearly rests and Penal Interest @ 2% Per Annum together with further interest, charges and other incidental expenses, costs thereon, till date of payment less repayments, if any, made after Demand Notice.

The attention of the Borrowers is invited to the provisions of Sec. 13 (8) of the SARFAESI Act, 2002, entitling you to redeem the property prior to publication of the notice of sale

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All That Piece And Parcel of Residential Property Admeasuring 58.50 Sq.mts Along With Construction Measuring 42.98 Sq.Mtrs thereon Situating at RSY No. 226/Paiki-1, Plot No 24, Bhai Pratap Township Village Varsamedi, Taluka Anjar, Dist Kutch, Gujarat ir The Name of Shri Ravi Kishanchand Hukumani by Virtue of Sale Deed No. 1239/2016 Date 22.02.2016 Of SRO Anjar and **Bounded By :- North:** Plot No. 23, **South**: Plot No. 25, **East**: Adj RSY No. 225, **West**: 9.00 MTS Internal Road. Sd/-. Authorised Office Date : 04.09.2023. Place : Gandhidham

The South Indian Bank Ltd.

55EC જાએસઇસી લિમિટેડ

કોર્પોરેટ ઓળખ નંબરઃ U52100GJ1965PLC001347 રજિસ્ટર્ડ ઓફિસ: ગુજરાત ચેમ્બર્સ બિલ્ડીંગ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯ ટેલિ.: ૦૭૯-૨૬૫૭૫૭૫૭ વેબસાઇટ: www.gsecl.co.in ઇમેઇલ: cs@gsecl.co.in ૫७મી વાર્ષિક સાધારણ સભા ની નોટિસ

આથી, માનનીય સભ્યશ્રીઓને, નોટિસ આપવામાં આવે છે કે જીએસઇસી લિમિટેડ ની પ૭મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) શુક્રવાર, સપ્ટેમ્બર ૨૯,૨૦૨૩ ના રોજ સાંજે ૦૪.૦૦ વાગ્યે દ્વિ-માર્ગીય વીડીયો કોન્ફરન્સીંગ (''વીસી'') / અન્ય ઓડીયો વીઝ્યુઅલ માધ્યમો (''ઓએવીએમ'') મારફત, કંપની ધારો, ૨૦૧૩ અને કોર્પોરેટ બાબતોનાં મંત્રલાય (એમસીએ) દ્વારા જારી કરાયેલ સામાન્ય પરિપત્રો નં.૧૪/૨૦૨૦ તા. ૦૮/૦૪/૨૦૨૦, નં.૧૭/૨૦૨૦ તા. ૧૩/૦૪/૨૦૨૦, નં.૨૦/૨૦૨૦ તા. ૦૫/૦૫/૨૦૨૦

નં.૦૨/૨૦૨૧ તા. ૧૩/૦૧/૨૦૨૧ અને નં.૧૦/૨૦૨૨ તા. ૨૮/૧૨/૨૦૨૨ ને અનુસરીને એજીએમની નોટિસમાં નિર્ધારીત કરેલ કામકાજ હાથ ધરવા માટે યોજવામાં આવશે. ઉપરોક્ત પરિપત્રોનું પાલન કરીને, જે શેરધારકોનાં ઇ-મેઇલ આઇડી ડિપોઝીટરી સહભાગી(ઓ) અથવા કંપની સાથે રજિસ્ટર્ડ કરાયેલા છે, એ તમામ શેરધારકોને એજીએમની નોટિસની અને નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનાં વાર્ષિક અહેવાલની લિન્ક ઇલેક્ટ્રોનિક મોડ મારફત મોકલેલ છે. ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.gsecl.co.in પર અને એનએસડીએલ ની વેબસાઇટ

કંપની ધારો, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોગવાઇ અને તે અંતર્ગત ઘડાયેલા મુજબ અનુસાર કંપનીએ તેના શેરધારકોને રિમોટ ઇ[.] વોટિંગ સવલત પુરી પાડેલ છે. કંપનીએ તેના બધાં જ સભ્યોને ઇ-વોટિંગનો સવલત પુરી પાડવા માટે અધિકૃત એજન્સી તરીકે એનએસડીએલ ની સેવાઓ રોકેલ છે.

ફીઝીકલ મોડમાં કે ડીમટેરીયલાઝ્ડ મોડમાં શેર ધરાવતા બધાં જ શેરધારકોને ઇલેક્ટ્રોનિક વોટિંગ દ્વારા મત આપવા માટેની પાત્રતા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૨ છે. રિમોટ ઇ-વોટિંગની સુવિધા ૩ (ત્રણ) દિવસ માટે ખુલ્લી રહેશે. રિમોટ ઇ-વોટિંગની મંગળવાર, **રકમી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૦૯.૦૦વાગ્ચે (IST)** શરૂઆત થશે અને **ગુરૂવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્ચે (IST)** સમાપ્ત થશે. રિમોટ ઇ-વોટિંગ સુવિધાને ઉપરોક્ત તારીખ કે સમયગાળા પછી મંજુરી આપવામાં આવશે નહીં. જે સભ્યો એજીએમ માં વીસી / ઓએવીએમ સુવિધા દ્વારા હાજર રહેશે અને રિમોટ ઇ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો મત આપ્યો ન હોય અને અન્યથા વોટ આપવાથી પ્રતિબંધિત ન હોય, તેઓ એજીએમ દરમ્યાન ઇ-વોટિંગ સુવિધા દ્વારા મત આપી શકશે.

સભ્યો રિમોટ ઇ-વોટિંગ દ્વારા તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કર્યા પછી પણ મીટીંગમાં ભાગ લઇ શકે છે પરંતુ મીટીંગ દરમ્યાન ફરીથી મતદાન કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. રિમોટ ઇ-વોટિંગ સુવિધા અને એજીએમમાં ઇ-વોટિંગ માટેની વિગતવાર સુચનાઓ એજીએમની નોટિસમાં આપેલ છે.

જે સભ્યોએ કંપનીના ડિપોઝીટરી સહભાગી / રજીસ્ટાર અને શેર ટ્રાન્સફર એજન્ટ સાથે તેમનાં ઇમેલ આઇડી નોંધાવેલ નથી અને ઇ વોટિંગ /રિમોટ ઇ-વોટિંગ દ્વારા મત આપવા ઇચ્છુક હોય તેઓને રિમોટ ઇ-વોટિંગ સુવિધા માટે વિગતવાર સુચનાનો સંદર્ભ લેવા વિનંતી કરવામાં આવે છે. તેની વિગતવાર સુચનાઓ એર્જીએમની નોટિસમાં આપેલ છે.

કોઇપણ વ્યક્તિ કે જે કટ-ઓફ તારીખે શેર ધરાવે છે અને એજીએમ ની નોટિસ મોકલાયા બાદ કંપનીના શેરધારક બને છે, તે બેજીએમની નોટિસમાં આપવામાં આવેલી સુચનાઓ અને ઇ-વોટિંગની પ્રક્રિયાને અનુસરીને તેમનો મત આપી શકે છે.

જે સભ્યોએ તેમનુ ઇ-મેઇલ સરનામુ નોંધાવેલ નથી, તેઓ નીચે મુજબની સુચનાઓનું પાલન કરવુ;

અ) ફીઝીકલ મોડ માં શેર ધરાવતા સભ્યોએ ફોલીઓ નંબર, સભ્યનું નામ, ઇ-મેઇલ એડ્રેસ, પાન કાર્ડ ની અને આધાર કાર્ડ ની સ્વ પ્રમાણિત નકલ જેવી જરૂરી

વિગતો કંપનીને cs@gsecl.co.in પર ઇ-મેઇલથી મોકલવા વિનંતી કરવામાં આવે છે.

બ) ડીમેટ મોડમાં શેર ધરાવતા સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઇ-મેઇલ એડ્રેસની નોંધણી માટે તેમનાં સંબંધિત ડિપોઝીટરી

આ બાબતમાં કોઇ પ્રશ્નો હોય તો, www.evoting.nsdl.com નાં ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરધારકો માટે વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs) અને શેરધારકો માટે ઇ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકા જોઇ શકો છો. શ્રીમતિ પલ્લવી મ્હાત્રેને evoting@nsdl.co.in પર વિનંતી મોકલો અથવા ૦૨૨-૪૮૮૬ ૭૦૦૦ અને ૦૨૨-૨૪૯૯ ૭૦૦૦ પર ફોન કરવો. જીએસઇસી લિમીટેડ વર્ત

ગાગાગ્રમભ : ભાલ તારીખ : ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩

ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડીઆઇએન : ૦૦૪૨૧૯૨૦

સહી/- રાકેશ શાહ

SARVESHWAR FOODS LIMITED

(Formerly Known as Sarveshwar Organic Foods Limited) CIN: L15312JK2004PLC002444 Registered Office: Sarveshwar House, Below Gummat, Jammu (J&K)-180001 | Telephone: 0191-2481954, 01923-220962 /ebsite: www.sarveshwarfoods.com | E-mail: investorrelations@sarveshwarrice.cor

NOTICE OF ANNUAL GENERAL MEETING Notice is hereby given that the 19th Annual General Meeting (AGM) of the members of

SARVESHWAR FOODS LIMITED (CIN: L15312JK2004PLC002444) will be held on Saturday, the 30th Day of September, 2023 at 11.00 A.M. at Country Inn & Suites, by Radisson, Opposite Bahu Plaza Complex, Gandhi Nagar Extension, Jammu J&K-180004 to transact the business as set out in the notice of AGM. Pursuant to the applicable circulars of MCA and SEBI, Notice of the AGM have been e

mailed to all the members whose e-mail ids are registered with their Depository Participant(s) or Company. The same is also available on the company's website www.sarveshwarfoods.com . The Notice of AGM is also available on the website of evoting agency at www.bigshareonline.com. The Company has completed sending of e mails of AGM Notice to members on September 06, 2023.

Further, Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a member may cast his/her vote electronically from a place other than the venue of AGM (remote e-voting) as set out in the business set forth in notice and members are requested to note the following:

- The remote e-voting period for all items of business contained in this Notice shall commence from Wednesday, September 27, 2023 at 09:00 A.M. and will end on Friday, September 29, 2023 at 5:00 P.M. During this period, Equity Shareholders of the Company holding shares either in physical form or in dematerialized form, as on Saturday, September 23, 2023 i.e. cut-off date, may cast their vote electronically and members will not be allowed to vote electronically beyond the said date and time. The e-voting module shall be disabled by Bigshare for voting thereafter. Once the vote on a resolution is cast by any Member, he/she shall not be allowed to change subsequently or cast vote again.
- The Cut-off date for eligibility to vote by electronic means or during the AGM is Saturday, September 23, 2023.
- Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at ivote@bigshareonline.com. However, if a person is already registered with Bigshare Services Private Limited for remote e-voting then existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details/Password?" or "Physical User Reset Password" option available on www.ivote.bigshareonline.com or contact Bigshare Services Private Limited at the following toll free no.: 1800 22 54 22.
- The facility for voting shall also be made available at the AGM by way of Ballot/ Polling Papers and the members attending the AGM who have not cast their vote by remote e voting shall be eligible to vote at the AGM. A member can opt for only one mode of evoting i.e. remote e-voting or polling paper.
- The Members who have cast their vote by remote e-voting may also attend the meeting but shall not be entitled to cast their vote again.
- A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting;
- In case of any queries, Individual Shareholders holding securities in demat mode with NSDL can contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 022-48867000 and 022-24997000 or Individual Shareholders holding securities in demat mode with CDSL can contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 or 22-23058542-43.

By the Order of the Board Sarveshwar Foods Limited

Sadhvi Sharma

તારીખઃ સપ્ટેમ્બર ૦૬, ૨૦૨૩

સ્થળઃ અમદાવાદ

કેમિસ્ટાર કોર્પોરેશન લિમિટેડ

રિજસ્ટર્ડ ઓફિસઃ ૬૦૪, માનસ કોમ્પલેક્ષ, જોધપુર ચારરસ્તા નજીક, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫, ગુજરાત. . સીઆઈએનઃ L24233GJ1994PLC022845 ઈ-મેઈલઃ kemistarbse@gmail.com વેબસાઈટઃ www.kemistar.in રલ્મી વાર્ષિક સામાન્ય સભા વિડિયો કોન્ફરન્સીગ (વીસી) / અન્ય ઓડીયો વિઝ્યુઅલ દ્વારા રાખવા અંગે જાણ, રેકોર્ડ તારીખ અને અંતિમ ડિવિડન્ડ સંબંધિત માહિતી

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીની રલ્મી વાર્ષિક સામાન્ય સભા લાગુ જોગવાઈઓનું પાલન કરીને શુક્રવાર, રલ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ બપોરે ૧૨:૦૦ વાગે વિડિઓ કોન્ફરન્સીન્ગ (વીસી) / અન્ય ઓડીંચો વિઝ્યુઅલ દ્વારા લેવામાં આવશે. કંપની એક્ટની જોગવાઈઓ, ૨૦૨૩ (એક્ટ) અને નિયમો ઘડવામાં અને સેળી (લિસ્ટિંગ ઓેબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સેબી (એલઓડીઆર) રેગ્યુલેશન) સમાન્ય પરિપત્ર નં ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૫ મે, ૨૦૨૦, ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, ૮ ડિસેમ્બર, ૨૦૨૧, ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ અને ૫ મે, ૨૦૨૨ અનુક્રમે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (એમસીએ પરિપગો) અને પરિપત્ર નં. સેબી/એચઓ/સીએફડી/સીએમડી૧/સીઆઈઓર/પી/૨૦૨૦/૭૯ તારીખ ૧૨ મે ૧૦૨૦, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ અને ૧૩ મે, ૨૦૨૨ ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી પરિપત્ર) દ્વારા સભ્યોની પ્રત્યક્ષ હાજરી સામાન્ય સ્થળે ગોઠવ્યા વિના કરવામાં આવશે.

સંબંધિત પરિપત્રની જોગવાઈ અનુસાર, સામાન્ય સભાની નોટિસ અને એન્યુઅલ રિપોર્ટ ૨૦૨૨-૨૩, કંપનીના નાણાંકિય વર્ષ ૨૦૨૨–૨૩ માટે નાણાંકિય નિવોદનો કંપનીના ડિરેક્ટર રિપોર્ટ, ઓડિટરના રિપોર્ટ અને બીજ જોડવા પડે તેવા અન્ય જરૂરી દસ્તાવેજો કંપનીના તમામ સભ્યો એવા સભ્યોને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે જેમનું ઈ-મેલ સરનામું કંપની/ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે નોંધાયેલ છે. ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.kemistar.in અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ એટલે કે www.bseindia.com તેમજ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની વેબસાઈટ એટલે કે www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ કરાવશે જ્યાં કંપનીના શેરોની યાદી છે.

શેરધારકો નોંધ કરી શકે છે કે તારીખ ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ યોજાનારી તેમની બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂા ૦.૪૦/– પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી. નાણાકિય વર્ષ ૨૦૨૩ માટે અંતિમ ડિવિડન્ડના હેતુ માટેની રેકોર્ડ તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ છે. આખરી ડિવિડન્ડ, એકવાર આગામી એજીએમમાં શેરધારકો દ્વારા મંજૂર કરવામાં આવે, તે શેરધારકોને વિવિધ ઓનલાઈ ટ્રાન્સફર મોડ હારા ઈલેક્ટ્રોનિક રીતે ચૂકવવામાં આવશે જેમણે તેમની બેંક ખાતાની વિગતો અપડેટ કરી છે. જે શેરધારકોએ તેમના બેંક ખાતાની વિગતો અપડેટ કરી નથી, ડિવિડન્ડ વોરંટ/ડિમાન્ડ ડ્રાફ્ટ/ચેક તેમના નોંધાચેલા સરનામાં પર મોકલવામાં આવશે. ડિવિડન્ડ મેળવવામાં વિલંબ ટાળવા માટે અને ચુકવણીની તારીખે સીધા તેમના બેંક ખાતામાં ડિવિડન્ડ મેળવવા માટે, શેરધારકોને તેમના કેવાયસી તેમની ડિપોઝિટરીઝ (જ્યાં શેર ડિમટીરિયલાઈઝડ મોડમાં રાખવામાં આવે છે) અને કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) (જ્યાં શેર ફિઝિકલ મોડમાં રાખવામાં આવે છે) સાથે અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે. ઈ-વોટિંગ હારા મત આપવાની રીતઃ

- (૧) ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઇ-વોટિંગ) દ્વારા એજીએમની નોટિસમાં જણાવ્યા મુજબ સભ્યોને વ્યવચાય પર પોતાના મત આપવાની તક મળશે.
- (૨) ડિમટીરિયલાઈઝ્ડ મોડ, ફિઝિક્લ મોડમાં અને જે સભ્યોએ તેમના ઈ–મેઈલ સરનામાં રજીસ્ટર કરાવ્યા નથી તેવા સભ્યો દ્વારા રિમોટલી (રિમોટ ઈ-વોટિંગ) મતદાન કરવાની રીત એજીએમની નોટિસમાં આપવામાં આવશે. (૩) ઈ–વોટિંગ માટેની સુવિધા એજીએમ ખાતે પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને એજીએમમાં ભાગ લેનારા સભ્યો કે
- (૪) ઈ-વોટિંગ ઢારા મત આપવા માટે લોગઈન ઓળખપત્રો સભ્યોને ઈ-મેઈલ ઢારા ઉપલબ્ધ કરવામાં આવશે. (૫) વીસી/ઓએવીએમ મારફતે એજાએમમાં હાજરી આપવા માટે સમાન લોગઈન ઓળખપત્રનો ઉપયોગ પણ થઈ શકે છે ઈ-મેઈલ સરામાં નોંધણી/અપડેટ કરવાની રીતઃ

જેમણે રિમોટ ઈ–વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો નથી તેઓ એજીએમમાં મત આપી શક્શે.

- જો તમે તમારૂં ઈ–મેઈલ સરનામું કંપનીમાં નોંધાવ્યુ ન હોય તો ડિપોઝિટરી, વાર્ષિક અહેવાલ મેળવવા માટે નીચેની સૂચનાઓનું પાલન કરો અને એંજીએમમાં જોડાવા/ઈ-વોટિંગ સુવિધાની કસરત કરવા માટે લોગઈન વિગતો : (૧[°]) **ફીઝીકલ હોલ્ડિંગઃ** કૃપા કરીને તમારા ફોલિયો નંબર, શેર હોલ્ડરનું નામ, શેર સર્ટિફિકેટની સ્કેન કરેલી કોપી (આગળ અને પાછળ) પાન (પાન કાર્ડની સ્વ–પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આધાર (આધાર કાર્ડની સ્વ–પ્રમાણિત સ્કેન કરેલ નકલ) કંપનીના ઈ–મેલ સરનામાં kemistarbse@gmail.com પર અથવા કંપનીના
- ૨જીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) પૂર્વા શેરજીસ્ટ્રી (ઇન્ડિયા) પ્રા. લિ. ને support@purvashare. com પર ઈ–મેલ દ્વારા મોકલી શકે છે. (૨) **ડીમેટ હોલ્ડિંગઃ** કૃપા કરીને તમારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરો અને તમારા ડીપી દ્વારા સૂચવવામાં

આવેલી પ્રક્રિયા મુજબ તમારા ઈ-મેલ સરનામાં ને તમારા ડીમેટ એકાઉન્ટમાં નોંધવો. સભાસદોને વિનંતી કરવામાં આવે છે કે એજીએમની નોટિસમાં નિર્ધારિત તમામ નોંધો અને ખાસ કરીને, એજીએઅમાં જોડાવા માટેની સૂચનાઓ, રિમોટ ઈ–વોટિંગ દ્વારા અથવા એજીએમ દરમિયાન ઈ–વોટિંગ દ્વારા મત આપવાની રીતને ચાનથી વાંચે**.**

કેમીસ્ટાર કોર્પોરેશન લિમિટેડ વતી.

કેતનકુમાર પટેલ મેનેજીંગ ડાયરેક્ટર (डीन नं.: ०११५७८८)

સહિ/-

PAUSHAK LIMITED

CIN: L51909G.I1972PLC044638 Regd. Office Address: Alembic Road, Vadodara - 390 003 Website: www.paushak.com | Email: investors@paushak.com Tel: +91 265 6637300

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE(S)

Notice is hereby given that the following Equity Shares Certificate(s) of the Company have been transferred to Investor Education and Protection Fund (IEPF) Authority and the registered equity shareholder(s) have reported them as lost/ misplaced and for the purpose of claiming the shares from IEPF Authority, the registered equity shareholder(s) have applied to the Company for the issue of duplicate Equity Shares Certificate(s).

Shareholder's and/or Claimant's Name	Folio No. (s)	Certificate No. (s)	Distinctive Nos.	No. of Shares
P Maruthai	P03498	2042	924461-924760	300
P Maruthai	P03498	2042	924461-924760	300

The Public is hereby warned against purchasing or dealing with these securities in any way. Any person(s) having any claim in respect of the aforesaid Equity Shares Certificate(s), should immediately send full details with documentary evidence to the Company's RTA - Link Intime India Private Limited at its office at B-102 & 103, Shangrila Complex, First Floor, Opp. HDFC Bank, Near Radhakrishna Char Rasta. Akota. Vadodara - 390020 or to the Company at its Registered Office mentioned above, so as to reach us within 15 days from the date of publication of this Notice, failing which, the Company will proceed to issue duplicate equity shares certificate(s) without further

Please note that no claims will be entertained by the Company or the RTA with respect to origina Equity Share Certificate(s) subsequent to the issue of duplicate(s) thereof.

For Paushak Limited

Date: 6th September, 2023 Sagar Gandhi Company Secretary Place: Vadodara

This Notice shall also be available at Investor Section of the Company's website www.paushak.com and Corporate Announcement Section of Stock Exchange's website www.bseindia.com

\Delta અરમાન ફાયનાન્સીયલ સર્વિસીસ લિમીટેડ

રજી.ઓફીસઃ ૫૦૨-૩, સાકાર-૩, જુની હાઈકોર્ટ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૧૪. ફોન નં. ૦૯૯-૪૦૫૦૯૦૦૦, ૨૯૫૪૧૯૮૯ CIN: L55910GJ1992PLC018623 Email: finance@armanindia.com, Website: www.armanindia.com

૩૧મી વાર્ષિક સામાન્ય સભા અને રીમોટ ઈ-વોટિંગની માહિતીની નોટિસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની 3૧મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શુક્રવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાકે એજીએમની નોટીસમાં જણાવ્યા મુજબના વ્યવસાયોના વ્યવહાર માટે કંપની ધારા, ૨૦૧૩ (ધારા) અને સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશનન્સ એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સેબી લિસ્ટીંગ રેગ્યુલેશન્સ, ૨૦૧૫)ની લાગુ પડતી જોગવાઈઓ અનુસાર એમસીએ અને સીક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ વિવિધ પરિપત્રો અન્વયે વિડિયો કોન્ફરન્સિંગ (VC)/ અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમ (OAVM) દ્વારા યોજાશે.

આથી કંપની ધારા ની કલમ ૯૧ અને સેબી લિસ્ટીંગ રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૨ અન્વયે પણ નોટિસ આપવામાં આવે છે કે, કંપનીના નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ ની એજીએમ માટે ૨જીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ શનીવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૩ થી શુક્રવાર, સપ્ટેમ્બર, ૨૯,૨૦૨૩ (બંને દિવસો સહિત) સુધી બંધ રહેશે.

એંજીએમની નોટીસ સહિતનો વાર્ષિક અહેવાલ જેમાં VC/OAVM દ્વારા એજીએમ માં જોડાવવા તથા ઈ-મતદાન કરવાની પ્રક્રિયા અને પધ્ધતિનો સમાવેશ છે તે અને અન્ય ડોક્યુમેન્ટસ સપ્ટેમ્બર દૃ, ૨૦૨૩ ના રોજ તે સભ્યોને મોકલવામાં આવ્યા થે જેમના ઈ–મેઈલ એડ્સ કંપની / ડિપોઝીટરીઝમાં નોંધાયેલા છે. વાર્ષિક અહેવાલ વેબલિક્સ https://www.armanindia.com અથવા https://www.evoting.nsdl.com પરથી ડાઉનલોડ કરી શકાશે.

નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ની ઈ-મતદાન સેવાઓ દ્વારા કંપની તેના સભ્યોને ઈલેક્ટ્રોનિક્લી

મતદાન (રિમોટ ઈ-મતદાન) કરવાની સુવિધા આપતા આનંદ અનુભવે છે. રિમોટ ઈ-મતદાનની અવધિ મંગળવાર, સપ્ટેમ્બર ૨૬, ૨૦૨૩ ના રોજ સવારે ૯:૦૦ વાગે શરૂ થશે અને ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે સમાપ્ત થશે. આ સમયગાળા દરમ્યાન શુક્રવાર સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૩ની કટઓફ તારીખ પ્રમાણે શેર ધરાવતા કંપનીના સભ્યો પોતાનો મત ઈલેક્ટ્રોનિકલી આપી શકે છે. ત્યારબાદ રિમોટ ઈ–મતદાન મોડ્યુલ NSDL દ્વારા બંધ કરવામાં આવશે. સભ્યો પાસે ઉપરોક્ત મતદાન અવધિ દરમ્યાન અથવા એજીએમ

દરમ્યાન રિમોટ ઈ-મતદાન સુવિધાનો ઉપયોગ કરીને કોઈ પણ ઠરાવો પર પોતાનો મત આપવાનો વિકલ્પ છે. જે સભ્યોએ એજીએમ પહેલા રિમોટ ઈ–મતદાન દ્વારા પોતાનો મત આપ્યો છે તે VC/OAVM દ્વારા પણ એજીએમમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેઓ ફરીથી મતદાન કરવા હક્કદાર રહેશે નહિં. રિમોટ ઈ-મતદાન અને એજીએમ દરમ્યાન ઈ-મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા એજીએમની નોટીસમાં આપવામાં આવી છે.

કોઈપણ સભ્ય ફીઝીક્લ સ્વરૂપે શેર્સ ધરાવતા હોય અને બિન-વ્યક્તિગત શેર હોલ્ડર્સ, જેઓએ કંપનીના શેર્સ ખરીદ્યા હોય અને નોટીસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બન્યા હોય અને કટઓફ તારીખ પ્રમાણે શેર્સ ધરાવતા હોય તેઓ evoting@nsdl.com પર રિક્વેસ્ટ મોકલી લોગઈન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો તે/તેણી પહેલાથી જ રિમોટ ઈ–મતદાન માટે NSDL સાથે રજીસ્ટર થયેલ હોય તો તે/તેણી તેઓના હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ મત આપવા માટે કરી શકે છે.

રિમોટ ઈ-મતદાન અંગે અથવા એજાએમમાં હાજરી આપવા અંગેના પ્રશ્નો અથવા સમસ્યાઓના કિસ્સામાં, કૂપા કરીને NSDL ચોથા માળે, એ–વિંગ ટ્રેડ વર્લ્ડ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ–૪૦૦૦૧૩, ઈ-મેઈલ: evoting@nsdl.com, ફોનં નં. ૦૨૨-૪૮૮૬૭૦૦૦ અને ૦૨૨-૨૪૯૯૭૦૦૦ નો સંપર્ક કરવો.

અરમાન ફાયનાન્સીયલ સર્વિસીસ લિમીટેડ વતી,

તારીખઃ ૦૬.૦૯.૨૦૨૩ ક્થળઃ અમદાવાદ

સહિ/-આલોક પટેલ જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર (DIN: 02482747)

આ નોટિસ કંપનીની વેબસાઈટ www.armanindia.com અને સ્ટોક એક્સચેન્જના કોર્પોરેટ જાહેરાત વિભાગ www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.



એસ્ટોન પેપર એન્ડ બોર્ડ મીલ લીમીટેડ

રજી. ઓફીસઃ ડી-७૦૨, હમો માળ, ગણેશ મેરીડીયન, હાઈકોર્ટ સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ-૩૮૦ ૦૬૦. ફોનઃ (079) 40081221, ફેક્સઃ (079) 40081220, સીઆઈએનઃ L21090GJ2010PLC063428 จัดเลเยือ: www.astronpaper.com भेยัด: cs@astronpaper.com

૧૩મી વાર્ષિક સાધારણ સભા, રીમોટ ઈ-વોટીંગ માહિતી, કટ-ઓફ અને બુક બંધ તારીખ સંદર્ભની નોટિસ આથી નોટીસ આપવામાં આવે છે કે, કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના તારીખ ૨૮મી ડીસેમ્બ૨, ૨૦૨૨, ૫મી મે, ૨૦૨૨, ૧૩મી

જાન્ચુઆરી, ૨૦૨૧, ૫મી મે, ૨૦૨૦, ૮મી એપ્રીલ, ૨૦૨૦ અને ૧૩મી એપ્રીલ, ૨૦૨૦ ના રોજના પરિપત્રની સાથે તેમજ સેબીના તારીખ ૧૨મી મે, ૨૦૨૦, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧, ૧૩મી મે, ૨૦૨૨ અને ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજના પરિપત્રની સાથે વંચાણે લેતાં (સંયુક્ત રીતે આ બધાનો ઉલ્લેખ પરિપત્રો તરીકે કરાયો છે) તે અન્વયે એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ લિમિટેડના સભ્યોની વર્3મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શુક્રવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ વાગે વિડિયો કોન્ફરન્સિંગ (વીસી) /અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા યોજાશે અને તેમાં તારીખ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૩ની એજીએમની નોટીસમાં દર્શાવાયા મુજબનું કામકાજ હાથ ધરાશે.

૧૩મી એજાએમની નોટીસ સાથે નાણાંકિય વર્ષ ૨૦૨૨–૨૩ માટેનો વાર્ષિક અહેવાલ સભ્યોને કંપની / ડીપોઝીટરીઝ પાર્ટીસીપન્ટસ પાસે તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ રજીસ્ટર્ડ હશે તેમને ઈ-મેઈલ પર મોક્લવામાં આવ્યા છે અને તે ઉપરાંત કંપનીની વેબસાઈટ www.astronpaper.com ઉપર તથા સ્ટોક એક્સચેન્જીસની, અર્થાત બીએસઈ લિમિટેડની અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઈટ્સ અનુક્રમે www.bseindia.com અને www.nseindia.com ઉપર પણ પ્રાપ્ત કરાયા છે તથા સેન્ટ્લ ડીપોઝીટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડની વેબસાઈટ www.evotingindia.com ઉપર પણ પ્રાપ્ત કરાશે.

વધુમાં, કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૮ તથા સુધારા સહિતના કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના રૂલ ૨૦ તેમજ સેબી (લીસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના નિયમન ૪૪નું પાલન કરતા, સભ્યોને એજીએમની નોટીસમાં દર્શાવ્યા મુજબના તમામ ઠરાવો ઉપર પોતાનો વોટ આપવા સીડીએસએલ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈલેક્ટ્રોનિક વોટિંગ સીસ્ટમ (ઈ-વોટિંગ)નો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે. શુક્રવાર ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ (કટ–ઓફ તારીખ)ના રોજ કંપનીની ભરપાઈ થયેલી શેર મુડીમાં સભ્યો જેટલા ઈક્વિટી શેર્સ ધરાવતા હોય તેના પ્રમાણમાં તેમના વોટિંગના અધિકારો રહેશે.

રીમોટ ઈ-વોટિંગનો સમયગાળો મંગળવાર, રદ્દ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે (આઈએસટી) શરૂ થશે અને ગુરૂવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ વાગે (આઈએસટી) પુરો થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો પોતાના વોટ ઈલેક્ટ્રોનિક્લી આપી શક્શે. રીમોટ ઈ-વોટિંગના માધ્યમથી વોટિંગ ગુરૂવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ રોજ ૫:૦૦ વાગ્યા પછી કરવા દેવાશે નહીં. જે સભ્યો વીસી/ઓએવીએમ સુવિધાના માધ્યમથી એજીએમમાં હાજર થયા હશે અને તેઓએ રીમોટ ઈ-વોટિંગથી પોતાના વોટ નહીં આપ્યા હોય તેમજ તેઓ વોટ આપવાથી વંચીત કરાયા ના હોય તેઓ એજાએમ દરમિયાન ઈ-વોટિંગના માધ્યમથી વોટ આપવાના અધિકારી રહેશે.

એજીએમ પહેલા જ રીમોટ ઈ–વોટિંગના માધ્યમથી પોતાના વોટ આપી દીધા હોય તે સભ્યો પણ વીસી/ઓએવીએમ સુવિધાના માધ્યમથી એજીએમમાં હાજર રહી શક્શે/ભાગ લઈ શક્શે, પણ તેઓ પોતાનો વોટ ફરીથી આપી શક્શે નહીં. કેટ-ઓફ તારીખના રોજ કંપનીના શેર્સ ધરાવતા હોય તેવા સભ્યોએ જ પોતાના વોટ આપવા. એજીએમની નોટીસ રવાના થઈ ગયા પછી કોઈપણ વ્યક્તિ કંપનીન સભ્ય બને અને કટ-ઓફ તારીખના રોજ તે શેર્સ ધરાવતા હોય, તેઓ એજીએમની નોટીસમાં દર્શાવવામાં આવેલી સુચનાઓ તથા ઈ–વોટિંગ/રીમોટ ઈ–વોટિંગની પધ્ધતિ અનુસરીને પોતાના વોટ આપી શક્શે. જે સભ્યોએ પોતાના ઈ-મેઈલ એડ્રેસીઝ નોંધાવ્યા ના હોય તેઓ અહીં નીચે દર્શાવ્યા મુજબની સૂચનાઓનું પાલન કરી શકે છે.

- એ) ફિઝિકલ સ્વરૂપે શેર ધરાવતા સભ્યોને વિનંતી છે કે તેઓએ અમારી રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ એટલે કે લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને ahmedabad@linkintime.co.in પર અને કંપનીને cs@astronpaper.com นะ ย์-भेस द्वारा तेमनी विगत भोडसवा विनंती छे. ४३री विगतो र्थभ डे इोसियो નંબર, સભ્યનું નામ, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પાનકાર્ડની સ્વયં પ્રમાણિત નકલો અને એડ-પ્રુફ તેમની ઈ–મેલ આઈડી નોંધણી માટે.
- **બી**) ડીમેટ સ્વરૂપે શેર ધરાવતા હોય તે સભ્યોને વિનંતી છે કે, તેઓએ પોતાના સંબંધિત ડીપોઝીટરી પાર્ટીસિપન્ટનો સંપર્ક કરી પોતાના ઈ-મેલ એડ્રેસીઝ નોંધાવી દેવા.

ઈ–વોટિંગ/રિમોટ ઈ–વોટિંગ મતદાન સંબંધિત વિગતો માટે, કૃપા કરીને ૧૩મી એજીએમની નોટિસ જુઓ. ઈ– વોટિંગ/રિમોટ સંબંધિત કોઈપણ પશ્નો/ફરિયાદો હોય તો એ માટે તમે www.evotingindia.com પર સીડીએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ આવર્તન પૂછાયેલા પ્રશ્નો (FAQs) અને ઈ-વોટિંગ મેન્યુઅલ રીફર કરી શકો છો અથવા તો શ્રી રાકેશ દલબી, મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ, એ-વિંગ, રપમો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ કંપાઉન્ડ્સ, એન.એમ.જોશી માર્ગ, લોઅ૨ પરેલ (પૂર્વ), મુંબઈ–૪૦૦૦૧૩નો સંપર્ક કરી શકો છો. અથવા helpdesk.evoting@cdslindia.com ને ઈ-મેલ કરી શકો છો અથવા ૦૨૨–૨૩૦૫૮૭૩૮ પર અથવા ૦૨૨–૨૩૦૫૮૫૪૨ પર અથવા ૦૨૨–૨૩૦૫૮૫૪૩ ઉપર કામકાજના તમામ દિવસોએ સંપર્ક કરી શકો છો.

કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ–૯૧ ને આધિન રહી, એ પણ નોટિસ આપવામાં આવે છે કે કેપનીના સભ્યોનું શેર રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ શનીવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ થી શુક્રવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ (બંને દિવસો સહિત) કંપનીની ૧૩મી વાર્ષિક સાધારણ સભાના હેતુથી બંધ રહેશે.

એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ લિમીટેડ વતી,

તારીખ: ૦૬.૦૯.૨૦૨૩ સ્થળ: અમદાવાદ

हिना रोनड पटेस,

કંપની સેક્રેટરી એન્ડ કંપલાયન્સ ઓફીસર

Company Secretary & Compliance Officer Place: Jammu